

B.A. Semester - 6 (CBCS) Examination
March/April-2025 (NEW COURSE)
PHI P22 YogaDarshan (Core -22 (New))

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન-૧ યોગદર્શન અને સાંખ્ય વચ્ચેનો સંબંધ સમજાવો. (૧૪)
 અથવા
- પ્રશ્ન-૧ ચિત્તનું સ્વરૂપ સમજાવી તેના પ્રકારો સમજાવો.
- પ્રશ્ન-૨ ચિત્તભુમી એટલે શું? તેના પ્રકારો સમજાવો. (૧૪)
 અથવા
- પ્રશ્ન-૨ ચિત્તવૃત્તિના અવરોધો વર્ણવો.
- પ્રશ્ન-૩ સમાધિ અને તેના પ્રકારો સમજાવો. (૧૪)
 અથવા
- પ્રશ્ન-૩ યોગમાં ઈશ્વરનું સ્થાન સમજાવો.
- પ્રશ્ન-૪ ચિત્તવૃત્તિના નિરોધના ઉપાય તરીકે અભ્યાસ અને વૈરાગ્ય સમજાવો.. (૧૪)
 અથવા
- પ્રશ્ન-૪ યોગના બહિરંગો સમજાવો .
- પ્રશ્ન-૫ દ્વંદ્વનોંધ લખો (કોઈપણ બે) (૧૪)
1. યોગની વર્તમાનમાં પ્રાસંગિકતા.
 2. પંચ કલેશ સમજાવો.
 3. ક્રિયાયોગ સમજાવો.
 4. કૈવલ્યનું સ્વરૂપ સમજાવો.

ENGLISH VERSION

- Que-1 Explain relation between yoga and sankhya. (14)
 OR
- Que-1 Explain of nature of Chitta and its types.
- Que-2 What is Chittabhumi? Explain its types. (14)
 OR
- Que-2 Describe the obstacles chittavrutti.
- Que-3 Explain the Samadhi and its types. (14)
 OR
- Que-3 Explain the place of God in Yoga.
- Que-4 Explain the Abhyas and Vairagya as the remedy of Chittavrutti. (14)
 OR
- Que-4 Explain the external organs of Yoga.
- Que-5 Write short answers: (any two) (14)
1. Importance of yoga in present era.
 2. Explain the five affliction.
 3. Explain the kriyayoga
 4. Explain the nature of Kaivalya.
